

Surbhi Industries Limited

Regd. Office 'Surbhi House', F. P. No. 206, 2nd Floor, B/h. Old Sub Jail, Khatodara, Ring Road, Surat - 395002 Gujarat, India. GSTIN: 24 AADCS 4385 E 1ZF

Date: 06.05.2022

PAN No.: AADCS 4385 E

To
The Manager
Department of Corporate Services
BSE Ltd.
Dalal Street, Fort
Mumbai – 400 001

Sub. -: Intimation of publication of Notice of Meeting of Board of Directors

Ref. -: Scrip Code - 514260

Sir / Madam,

With regards to the captioned subject please find enclosed herewith the notice of meeting of Board of Directors published in Western Times English Newspaper and Western Times Guajarati Newspaper.

Kindly take the same on your records and acknowledge the receipt.

Thanking you,

Yours faithfully,

For Surbhi Industries Limited

Raviibhai P. Patel Managing Director

DIN: 00023332

Encl: as above

Tel: +91 261 2209500 Email: info@surbhi.com Web: www.surbhi.com CIN: L17110GJ1992PLC017672

says Goa Minister

Business Brief III

3 labourers death case: Lapse

on part of Zuari Agro Chemicals,

Panaji, May 4 (IANS) The state Ministry for Fac-

tories and Boilers' prima facie probe into the death

of three labourers in an accident at the Zuari Agro

Chemicals plant in South Goa has found lapses on

part of the company's processes, Minister Nilkanth Halarnkar said on Wednesday. Speaking to reporters a day after the accident claimed three lives, Halarnkar also said that the fa-

tal industrial accident occurred after workers at-



Dalal Street in focus as LIC IPO opens for subscription

New Delhi, May 4 (IANS) The Dalal Street would be in focus as the subscription for the initial public offering of insurance major Life Insurance Corporation has

opened on Wednesday. The long-awaited Initial Public Offering (IPO) for the LIC will remain open to subscription till May 9.

The government has brought down the issue size from 5 per cent to 3.5 per

It will be a landmark public issue in the history of the Indian capital market and is poised to be India's biggest IPO till date.

The IPO values LIC at Rs 6 lakh crore.

The issue offer of the LIC will be in the price band of Rs 902 to Rs 949.

Also, the policyholders

will be offered a Rs 60 discount, while for retail investors, the discount will be Rs

Domestic mutual funds reportedly invested Rs 4,002 crore, accounting for a little over 71 per cent of the total anchor book portion of the much-awaited initial public offering (IPO) of Life Insurance Corporation (LIC).

The insurance major mobilised a total of Rs 5,627 crore from anchor investors on Monday.

An anchor investor in an IPO is a qualified institutional buyer (QIB) which invests before the IPO is made available to the public as per market regulator SEBI's regulations in order to instill confidence among inves-

Bajaj Allianz Life Ins. leads the private insurance sector with a growth rate of 49% in FY2022

Mumbai, Bajaj Allianz ife Insurance Company Limited, one of India's leading private life insurers, continued to clock impressive growth on individual rated new business (IRNB) premium by registering a 49.4% growth in FY2022. The company recorded the highest growth (among the top 10 private players) of 39.3% in the month of March 2022 alone, at the back of its comprehensive range of prod-

Tarun Chugh, MD & CEO, Bajaj Allianz Life, commented, "Happy to have wrapped the previous financial year with a strong growth of 49% in individual rated new business pre-

ucts, innovative digital ser-

vices and a robust sales net-

mium (the highest amongst robust network of both the top-10 private market players on IRNB basis). It's a reflection of our consolidated efforts across business parameters – including

online and offline partners, including our own agents and proprietary sales force. These are key aspects that will help us in the year

ahead as well. Bajaj B BAJAJ Allianz (11) Allianz Lífé continues

3ajaj Allianz Life Insurance Co. Ltd. Wards offer-

are focusing on and working towards being a preferred partner when it comes to investing towards any long-term financial goals. We closed the financial year with not only a strong product portfolio, but also an equally strong distribution network with a

quality of the business we write, persistency that we are focusing on and work are focusing on an and work are focusing on an are focusing on a superior of the business we write a superior of the business we write, persistency that we have a superior of the business we write an area of the business we will be a superior of the business we write a superior of the business we will be a superior of the business will be a superior of the business we will be a superior of the business will be a su aided service options. We are confident that as an organisation we will keep the foot on the pedal and work towards enabling many more customers

to invest to-

Bajaj Allianz Life continues to grow rapidly with a

achieve their life goals with

49.4% uptick in the IRNB premium, while the industry grew by 15.7% and the private life insurers' growth stood at 21.9% in FY2022. The company's regular premium average ticket size also elevated to Rs. 77,634 in FY2022 from Rs. 57,782 in FY2021, registering a growth of 34.4%.

The company also observed an increase in IRNB premium of Rs. 3,686 crores in FY2022 from Rs. 2,468 crores in FY2021. The renewal premium witnessed a growth of 22.4% in FY2022, rose to Rs. 6,991 crores from Rs. 5,712 crores in FY2021. The gross written premium for Bajaj Allianz Life stood at Rs. 16,127 crores in FY2022 from Rs. 12,025 crores in

Samsung inks \$1 bn 5G deal with **US network operator DISH**

San Francisco, May 4 (IANS) US network operator Dish has picked Samsung to supply 5G network

Samsung will deploy 5G Open Radio Access Network solutions across DISH Wireless SMART 5G network. The companies will collaborate to deploy Samsung's 5G solutions and radio units in markets across the US, supporting DISH's 5G commercial services"Samsung's 5G solutions will play an inte-



expansion, giving us the flexibility to deploy our cloud-native network with softwarebased solutions that support advanced services and operational scalability," said John Swieringa, president

and chief operating officer, DISH Wireless. In 2020, Samsung grabbed a deal worth \$6.6 billion from US carrier Verizon to supply 4G and 5G network equipment."Samsung is excited to join this 5G journey with DISH, a pioneer in bringing new experiences to households and businesses around the country, leveraging openness and virtualisation that sit at the heart of network evolution," said Mark

Apple hires veteran Ford

San Francisco, May 4 (IANS) Apple has report-

on

iPhone maker has partnered with a South Korean company to develop the autopilot chip for its car.According to TheElec, Apple partnered with a South Korean outsourced semiconductor assembly and test (OSAT) company to develop its car's autópilot tech-

Instagram testing TikTok-like

San Francisco, May 4 (IANS) Meta-owned photo sharing platform Instagram is experimenting with full-screen vertical home feeds.

ter, Instagram head Adam Mosseri confirmed the test and said that taller photos and videos would begin appearing in some feeds."We are testing a new, immersive viewing experience in the main Home feed. If you are in the test, check it out and let



me know what you think," Mosseri captioned the video on the micro-blogging platform. According to me-

dia reports, users can still use the bottom navigation bar to access the discovery tab, Reels, shopping and their

own page in the test of the full-screen home feed. Meanwhile, last month, the photo-sharing platform confirmed that it is exploring a new feature that lets users pin specific posts to their profile above their photo grid. The new feature is currently in the testing phase and is showing up for select users on the platform. Users who have access to the feature are seeing a "Pin to your profile" option that they can select from the three-dot menu next to Digital marketing of unhealthy

foods, online gaming driving obesity: WHO

London, May 4 (IANS) Digital marketing of unhealthy food products to children and online gaming that compels children to a sedentary life are the main drivers of obesity, the World Health Organisation (WHO) has said.

According to the WHO European Regional Obesity Report 2022, rates of overweight and obesity have reached "epidemic proportions", with only the Americas having a higher level of obese adults than Europe. The global health body added that while nearly 60 per cent of adults and a third of children are overweight or obese, the last two years of Covid-19 pandemic made that worse. 'Obesity knows no borders. In Europe and Cen-

tral Asia, no single country is going to meet the WHO Global NCD target of halting the rise of obesity," said Hans Henri P. Kluge, WHO Regional Director for Europe, while presenting the report at the European Congress on Obesity. The countries in our Region are incredibly diverse, but every one is challenged

Share of retail investors in companies listed on NSE reaches all-time high of 7.42%

New Delhi, May 4 (IANS) Share of retail investors (individuals with up to Rs 2 lakh shareholding) in com-panies listed on NSE reached an all-time high of 7.42 per cent as on March 31, 2022 from 7.33 per cent as on December 31, 2021, as per Primeinfobase, an initiative of Prime Database

In INR value terms too, retail holding in companies listed on NSE reached an alltime high of Rs 19.16 lakh crore from Rs 19.05 lakh crore on December 31, 2021, an increase of 0.56 per cent, according to Pranav Haldea, Managing Director, PRIME Database Group. Sensex and Nifty rose by 0.54 and 0.63 per cent respectively during this period. Despite share of High Net Worth Individuals (HNIs) (individuals with more than Rs 2 lakh shareholding) in companies listed on NSE declining marginally to 2.21 per cent as on March 31, 2022 from 2.28 percent on December 31,

Bengaluru, May 4 (IANS)

Seven in 10 office workers in

India are under increased

pressure at work due to more

and more colleagues resign-

ing in the past year, the high-

est in any region, a new report showed on Wednesday. Mo-

notonous tasks are amplify-

ing employee unhappiness

and uncertainty and they

would welcome new pro-

cesses and technologies such

as automation to allow them

I HAVE CHANGED MY OLD

NAME **PATEL**

BHARATKUMAR RAMBHAI

TO NEW NAME **PATEL**

BHARATBHAI RAMBHAI

ADD: A-402. Swaman

I Have Changed My Name

From VANDARA KASHMIRA

JIVRAJ To VALA HINABEN

NARENDRABHAI.

Add: A- 22, Shiv Sagar

Society,

Gopi Bunglows, Vastral

Ahmedabad- 382418

2021, the combined retail and HNI share reached an all-time high of 9.64 per

According to Haldea, net outflows from Foreign Portfolio Investors (FPIs) of a huge Rs 1.10 lakh crore dur-



ing the quarter resulted in FPIs share declining further to a 9-year low of 20.15 per cent as on March 31, 2022, from 20.71 per cent as on December 31, 2021.Most notably, FPIs pulled out Rs 69,370 crore from Financial Services and Software sector during the quarter while investing Rs 13,450 crore in Metals & Mining and Food, Beverages & Tobacco. Holding of FPIs (in INR value terms) in companies listed

to focus on work that matters,

according to the report by

UiPath, an enterprise auto-

mation software company.

"In India, 79 per cent of re-

spondents said they have

had to take up to six new

tasks or responsibilities out-

side of their job description

due to co-workers resigning,"

said Anil Bhasin, Managing

Director and Vice President,

UiPath-India, and South Asia.

"Ninety-nine per cent feel

CHANGE OF NAME

I have changed my name

from PATEL

MUNEERAHMED

MEHBOOB to PATEL MUNIRAHMED MAHEBUB

Resi. Bhilvaspura.

H59

on NSE stood at Rs 51.99 lakh crore as on March 31, 2022, a decrease of 3.36 per cent from Rs 53.80 lakh crore as on December 31, 2021.According to Haldea, share of domestic Mutual

Funds in companies listed on NSE rose for the third quarter running and reached 7.75 per cent as on March 31, 2022, up from 7.46 per cent as on December 31, 2021.

This was after 5 quarters of consecutive decline from

March 31, 2020 (7.96 per cent) to June 30, 2021 (7.24 per cent). The share has increased on the back of net inflows by domestic Mutual Funds of a huge Rs 67,423 crore during the quarter. In INR value terms too, the holding of domestic Mutual Funds went up by 3.08 per cent to an all-time high of Rs 19.99 lakh crore as on March 31, 2022 from Rs 19.39 lakh crore on December 31,

automating certain tasks can

improve their job perfor-

mance by saving time, in-

creasing productivity, and

creating opportunities to fo-

cus on more important work,'

he added. More employees

around the world are burnt

70% Indian workers feel burnt out as more colleagues quit in past year

Eris enters Dermatology therapy through the acquisition of Oaknet Healthcare

Mumbai, Lifesciences Limited, a leading Indian branded formulations manufacturing company, yesterday announced its acquisition of a 100% stake in Mumbai-based dermatology focused domestic formulations company Oaknet Healthcare Pvt Ltd for a total consideration of INR 6,500 mn.

With a revenue base of INR 1,950 million in FY22, Oaknet brings a well-established portfolio of leading brands in Dermatology and Women's Health to the Eris stable. Eris' Specialty Franchise will get a significant impetus with this acquisition with Eris now present in 87% of the INR 55,000 crore Chronic Market, with a leading presence in the major ChronicTherapies in the IPM

- Cardiology, Oral diabetes care, Insulin, Neuro/CNS and Dermatology. Oaknet has near 100% coverage of approx. 11,000 Dermatologists across India with a 60%

While 73 per cent of Indian re-

spondents say they are inter-

ested or could be swayed into

looking for a new job in the

next six months, about two in

five say they are currently ap-

plying for another job, or have had interviews with another

company in the past six

months.



penetration and has a pan India sales and distribution presence. Commenting on the acquisition, Mr. Amit Bakshi, Chairman & Managing Director of Eris Lifesciences Ltd., said, "As Oaknet becomes part of the Eris Group, it provides us with a robust growth plat-form in the areas of Dermatoloy and Cosmetology. In line with Strides and Zomelis acquisitions, we are confident that the Oaknet transaction will create longterm value for our shareholders."Mr. Krishnakumar V, Executive Director & Chief

CHANGE OF NAME

I HAVE CHANGED MY OLD NAME KRITIKA AJIT VASHISTH TO NEW NAME KRITIKA SINGH VASHISTH ADDRESS: 24 SIDDHIVINAYAK BELLA

CASA KASINDRA AHMEDABAD 382210

I Hitherto Known As **CHAUDHARI VANDANA** W/o DILIP Residing At 157-1, Laxminagar, Nr.Last

CHANGE OF NAME

Lifesciences Ltd., added,

"The acquisition of Oaknet

brings marquee brands like

Cosvate and Cosmelite into

the Eris portfolio. We expect

to bring to bear multiple

value creation levers includ-

ing in-house manufactur-

ing, new product launches,

expansion of field force pro-

ductivity and enhancement

of operational efficiency."

Bus Stop Meghaninagar, Ahmedabad-380 016 Have Changed My Name And hereafter Be Known As LATABAI DILIP **CHAUDHARI**

:CORRIGENDUM-1:

Following rectification is made in Short E-Tender Notice No.2 OF 2022-23 OF Executive Engineer Ukai Division No.1, Ukai PIN CODE NO.394680 Phone No.02624-233221 Dist: Tapi. Tender Id.517396, 517609, 517582, 517540.

	В	Schedule of E-Tendering	Earlier As Printed	Now to be Read As.
	4	Name of Work	Consitruction of new Laboratory Building at Ukai Ta. Sangadh Dist. Tapil	Consitruction of Quellity Control Unit Facilliating With Latest Equipments at Ukai Ta.Songadh Dist. Tapi
	1	Downloading/Uploading date and Time of Tender Document.	Dt.12-04-2022 to Dt.02-05-2022 up to 18.00 hrs.	Dt.12-04-2022 to Dt.17-05-2022 up to 18.00 hrs.
	2	Pre-bid Conference Date and Time (For Tender Id 517396 only)	Date:-20/04/2022 12.00 Hrs. The Superintending Engineer, Ukai circle (Civil), Conference Hall, 2 nd Floor, Tapi, Jal Bhavan, Ukai, Ta. Songadh Dist. Tapi- 394680	Date:-06/05/2022 12.00 Hrs. The Superintending Engineer, Ukai circle (Civil), Conference Hall, 2 nd Floor, Tapi Jal Bhavan, Ukai. Ta.Songadh Dist.Tapi- 394680
	3	Last Date and Physical Submission of document Tender fee, EMD during office Hrs. by RPAD/Speed Post/Courier only.	Dt.09-03-2022 at 18.00 Hrs. Executive Engineer, Ukai Division No.1, Ukai. Ta.songadh Dist Tapi-394680	Dt.23-05-2022 at 18.00 Hrs. Executive Engineer, Ukai Division No.1, Ukai. Ta.songadh Dist Tapi-394680
	4	P.Q.Bid Opening Date and Time	On Dt.10-05-2022 Hrs. Superintending Engineer, Ukai Circle (Civil), Ukai Dist. Tapi-394680	On Dt.24-05-2022 Hrs. Superintending Engineer, Ukai Circle (Civil), Ukai Dist. Tapi-394680

· All other conditions/Provisions of Tender will remain unchanged. · In future if Any Other Change and/or correction in Tender Documents is done, it will be

done online on www.nprocure.com. Further details please visit us at above stated office during office hours. details are also

available on web Site www.nprocure.com other conditions remains unchanged. Mahiti/Surat/158/2021

Nr. Nawabkhan's Bunglow, Solarity, R.J. Prime Road, Nr. Aditya Green, Zundal Shahealam, Danilimda, Ahmedabad. Gandhingar-382421

CHANGE OF NAME I HAVE CHANGED MY OLD NAME PATEL SURYABEN **BHARATKUMAR** TO NEW

ADD: A-402, Swaman olarity, R.J. Prime Road, Nr Aditya Green, Zundal, Gandhingar-382421 458

NAME PATEL SURYABEN

BHARATBHAI

PUBLIC NOTICE That Flat No. 106 on fourth floor admeasuring 88.62 Sq.

Mtrs. construction in Suyash Members Association which is also known as Suyash Apartment on land bearing T.P.S. No. 1 P.P. No. 257 Sub Plot No. 1 to 4 Mouje Memnagar Ta. Ghatlodiya Dist. Sub-Dist. Ahmedabad-3 (Memnagar) owned and possessed by (1) Rita Sudhirkumar Gupta (2) Vikas Sudhirkumar Gupta. Original sale deed No. 4858 dated 20-11-1995 executed by first allottee member (1) Balbirsingh B. Soni (2) Pratimakaur B. Soni (3) Indramohansingh Balbirsingh Soni in favour of Rameshchandra J. Goyel of abovementioned property was lost. Hence on basis of original sale deed No. 4858 dated 20-11-1995 or by any other way if any other person, bank or any other financial institution has any right, title or interest in the said property are requested to send their claims within seven days at below mentioned address and if any claim is not received by me further procedure will be completed and no objection certificate will be issued. Date: 4-5-2022

Rupesh A. Bhagat (Advocate & Notary) Jignesh A. Bhagat (Advocate & Notary) For Bhagat Associates Address: 302-A/B, Sheel Complex, B/h. Aagman

Complex, Mithakhali, Ahmedabad. Tel. No. (079) 26406825

Regd.off: "SURBHI HOUSE", 2nd Floor, F. P. No. 206, B/h Old Sub-Jail, Rin Road, Khatodara, SURAT GUJARAT 395002 NOTICE

Pursuant to Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on 12th day of May 2022, at 12.00 PM at Registered office of the company inter alia, to consider, approve and take on record the Audited Financial Results of the Company for the quarter and year ended 31st March Further, details are also available on Company's website

www.surbhi.com as well as Stock Exchange's website i.e. www.bseindia.com. By order of the Board For, SURBHI INDUSTRIES LTD

Place : Surat

Date: 04.05.2022

RAVJIBHAI PARBATBHAI PATEL

Managing Director

out by having to take on more work due to colleagues resigning and various monotonous tasks Alarmingly, 74 per cent of Indian and 68 per cent of global respondents reported that they do not know what their responsibilities are anymore, because things at work have changed so much since their coworkers quit.

CHANGE OF NAME I have changed my name

rom MEET SANJAYKUMAR BRAHMBHATT to new Name **DEVARSH SANJAYKUMAR** BRAHMBHATT Add: 201, Jay Madi Appartment, Bopal, Ahmedabad. 460A

I have changed my minor son's name from SANJAYKUMAR POPATLAL **BAROT** to new Name SANJAYKUMAR POPATLAL **BRAHMBHATT** Add: 201, Jay Madi Appartment, Bopal, Ahmedabad.

CHANGE OF NAME I have changed my name from LAKSHMIBEN

PANKAJKUMAR PATEL to new Name PATEL **RANJANBEN PANKAJKUMAR** Add: At. Moyad Rupajivas, Movad, Ta. Prantii. Dist. Sabarkantha

Form No. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI [Pursuant to section 374(b) of the companies

Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

(Authorised to Register) Rules, 2014]

Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application has been made to the Registrar at Central Registration Centre, Indian Institute of Corporate Affairs (IICA), Plot no. 6,7,8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana, India, 122050 that YAS SIR, a partnership firm may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares

To carry on the business of buying, selling, renting and operating of self-owned or leased real estate such as apartment building and dwellings, non-residential buildings, developing and subdividing real estate into lots and also includes, development and sale of land and cemetery lots, operating of apartment hotels and esidential mobile home sites. A copy of the draft memorandum and articles of association of the

proposed company may be inspected at the office at 701, North Plaza, 4d Square Mall, Motera, Ahmedabad, Gujarat 380005

Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre, Indian Institute of Corporate Affairs (IICA), Plot no. 6, 7, 8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana, India, 122050, within twenty-one days from the date of publication of this notice, with a copy to the company at its registered office. Dated this 5th day of May, 2022

3. Sanamkumar Dineshbhai Kadiya 4. Akash Jayantkumar Sathavara 5. Jay Rameshbhai Prajapati

CIN- L65923GJ1994PLC021479 Regd. Office: F.P. No. 123, B/h. Andaz Party Plot, Makarba Cross Road S.G. Highway, Makarba, Ahmedabad. Extract of Standalone Audited Financial Result for the Quarter and year ended as on 31/03/2022 Rs.

	31/03/2022 (Audited)	31/03/2021 (Audited)	31/03/2022	31/03/2021
Total Income From Operations	5.46	6.88	28.67	31.88
Net Profit/ (loss) (before Tax,	5.19	0.50	0.87	3.05
Exceptional and/or Extraordinary				
items)				
Net Profit/ (loss) before Tax (after	5.19	0.50	0.87	3.05
Exceptional and/or Extraordinary				
items)				
Net Profit/ (loss) after Tax, (after	5.19	-1.77	0.87	0.78
Exceptional and/or Extraordinary				
items)				
Total Comprehensive Income for	5.19	-1.77	0.87	0.78
the period [Comprising profit/(loss)				
for the period (after Tax) and other				
Equity Share Capital (Re. 1/- each)	720.00	720.00	720.00	720.00
Other Equity (as shown in the	-	-	313.28	312.30
balance sheet of previous year)				
Basic and Diluted Earning per	0.007	-0.002	0.001	0.001
share (FV of Re. 1/- each)				

Regulations, 2015. The full format of quarterly Financial Results are available on the website of Stock Exchange at www.bseindia.com and also on the

Chairman & Managing Director DIN NO : 00055770

Surbhi Industries Limited CIN NO.L17110GJ1992PLC017672

The principal objects of the company are as follows

Name(s) of Applicant 1. Keyur Dineshbhai Kadiya 2. Yaminiben Naileshbhai Pandya

SUMERU INDUSTRIES LIMITED Particulars Quarter ending as on Year ended as on

	(Auaitea)	(Auaitea)		
Total Income From Operations	5.46	6.88	28.67	31.88
Net Profit/ (loss) (before Tax,	5.19	0.50	0.87	3.05
Exceptional and/or Extraordinary				
items)				
Net Profit/ (loss) before Tax (after	5.19	0.50	0.87	3.05
Exceptional and/or Extraordinary				
items)				
Net Profit/ (loss) after Tax, (after	5.19	-1.77	0.87	0.78
Exceptional and/or Extraordinary				
items)				
Total Comprehensive Income for	5.19	-1.77	0.87	0.78
the period [Comprising profit/(loss)				
for the period (after Tax) and other				
Equity Share Capital (Re. 1/- each)	720.00	720.00	720.00	720.00
Other Equity (as shown in the	-	-	313.28	312.30
balance sheet of previous year)				
Basic and Diluted Earning per	0.007	-0.002	0.001	0.001
share (FV of Re. 1/- each)				
Note: The above is an extract of the detailed format of quarterly Financial Result				
filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR)				

Company's website at www.sumerugroup.in. **VIPUL H RAJA** Date: 03/05/2022

Ahmedabad, Page 7

tempted to cut open a gas tank with a flaming gas cutter."Labourers were trying to open the gas tank with a gas cutter. The nuts and bolts had rusted. This

led to the blast," Halarnkar told reporters here. 'The company has committed negligence.There was no plant manager site manager (onsite)," he also said. Halarnkar also said that his department would carry out a thorough investigation into the tragedy."Prima facie investigation has been conducted. Department will carry out a thorough investigation and it appears that there was a lapse on part of the company," Halarnkar said.

solutions in a multi-year deal worth over \$1 billion.

gral role in our network



Louison, executive vice president and head of the Networks Business, Samsung Electronics America.

executive for EV car project

edly hired veteran Ford executive Desi Ujkashevic, as the iPhone maker plans to launch an electric car in 2024. Multiple reports claimed that Ujkashevic, who is Ford's global director of safety engineering, will join Apple to help it develop a fully electric autonomous car. Ujkashevic joined Ford 31 years ago and worked across disciplines, including developing EVs, She worked on a range of Ford and Lincoln SUVs, as well as Ford's Fiesta and Focus compact

Ujkashevic could help Apple navigate regulatory hurdles the company faces in testing self-driving prototypes on public roads, reports TechCrunch.

"Her expertise in engineering and safety protocol can also help guide Apple in its project," the report mentioned late Tuesday.The



fullscreen feed

In a video posted on micro-blogging site Twit-





પંજાબનો ધમાકેદાર વિજય, ગુજરાત ટાઈટન્સને હરાવ્યું

(એજન્સી) નવી દિલ્હી.

ઝડપી બોલર કાગિસો રબાડાની ઘાતક બોલિંગ બાદ શિખર ધવનની અડધી સદી અને ભાનુકા રાજપક્સેની આક્રમક બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ સામે આઠ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૨માં મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સને વિજય માટે વધારે મહેનત કરવી પડી ન હતી. પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. સાઈ સુદર્શનની ૬૫ રનની ઈનિંગ્સની મદદથી ગુજરાત ટાઈટન્સને ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૩૨નનો સ્કોર નોંધાવ્યો હતો. પરંતુ શિખર ધવન અને રાજપક્સેની જોડીએ આ સ્કોરને વધારે આસાન બનાવી દીધો હતો. પંજાબે ૧૬ ઓવરમાં બે વિકેટે ૧૪૫૨ન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ધવન ૬૨ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાતનો આ બીજો પરાજય હતો અને હાલમાં ટીમ ૧૬ પોઈન્ટ સાથે ટોચ પર છે. પંજાબ કિંગ્સ સામે ૧૪૪ રનનો લક્ષ્યાંક હતો જે ધવન અને રાજપક્સેની જોડીએ આસાન બનાવી દીધો હતો. ટીમે ૧૦ રનના સ્કોર પર જોની બેરસ્ટોની વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં ઓપનર ધવને રાજપક્સે સાથે મળીને તાબડતોંબ બેટિંગ કરી હતી. આ જોડીએ ગુજરાતના બોલર્સને હંફાવ્યા હતા અને વધારે સફળ થવા દીધા ન હતા. ગુજરાતના બોલર્સ એક પણ સમયે બંને બેટરને દબાણમાં લાવી શક્યા ન હતા. આ જોડીએ ૮૭ રનની ભાગીદારી નોંધાવી હતી. રાજપક્સે ૨૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે૪૦ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોને ૧૦ જ બોલમાં ૩૦ રન ફટકારીને ટીમના આસાન વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે ૧૦ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. જ્યારે ધવન ૫૩ બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી દૂર રન નોંધાવીને અણનમ રહ્યો હતો. ગુજરાત માટે મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસને એક-એક વિકેટ ઝડપી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો પંરતુ તેના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી પરંતુ તે સિવાય કોઈ બેટર મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. ગુજરાતે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમે ૧૭ રનના સ્કોર પર શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી.

ચોગી આદિત્યનાથ પાંચ વર્ષ બાદ ઘરે પહોંચ્યા, માતા સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા

(એજન્સી) દેહરાદૂન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ દિવસના પ્રવાસ પર ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથનો આ પ્રથમ ઉત્તરાખંડ પ્રવાસ છે. યોગી આદિત્યનાથ દેહરાદૂનના જૌલીગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેબિનેટ મંત્રી પ્રેમચંદ અગ્રવાલ, પૂર્વ

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેમનું

એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું. ઉત્તરાખંડ પહોંચીને યોગી આદિત્યનાથે પાંચ વર્ષ બાદ પોતાના માતા સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તસવીર ટ્વિટર પર શેર કરતા યોગી આદિત્યનાથે માત્ર એક શબ્દ લખ્યો 'માં'. સાથે બિધ્યાણીમાં મહાયોગી ગુરૂ ગોરખનાથ રાજકીય મહાવિદ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા યોગી આદિત્યનાથ પોતાના ગુરૂને યાદ્ કરતા ભાવુક પણ થઈ ગયા અને

કહ્યુ કે, તેમની જન્મભૂમિમાં તેમનું મૂર્તિનું અનાવરણ કરતા તે પોતાને સૌભાગ્યશાળી અનુભવી રહ્યાં છે. મહત્વનું છે કે મહંત અવૈદ્યનાથનો જન્મ અહીના કાંડી

ગામમાં થયો હતો, પરંતુ ૧૯૪૦ બાદ તે ત્યાં કચારેય ગયા નહીં. આ સંબંધમાં યોગીએ કહ્યુ કે, મહંત અવૈદ્યનાથ અહીં વધુ સમય રહ્યા નહીં, પરંતુ તે હંમેશા ત્યાંની શિક્ષણ વ્યવસ્થા વિશે પૂછતા રહેતા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેમણે મહંત અવૈદ્યનાથને જણાવ્યુ હતુ કે અહીં કોઈ ડિગ્રી કોલેજ નથી અને તેમની પ્રેરણાથી અહીં મહાવિદ્યાલયની સ્થાપના થઈ છે. યોગી આગિત્યનાથે આ તકે પોતાના દ સ્કૂલી શિક્ષકોને પણ સન્માનિત કર્યા અને કહ્યું કે, તે આ માટે ગૌરવ અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, તેમને જન્મ પૌડીના પંચૂર ગામમાં થયો અને યમકેશ્વર નજીક ચમોટખાલની એક સ્કૂલમાં તેમણે ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો. તેમણે કહ્યું કે અહીં આવી તેમને પોતાના તે સ્કૂલ શિક્ષકોની યાદ આવી રહી છે જે હવે દુનિયા છોડી ચુક્યા છે.

મચ્છરોથી નહીં, વાંદરાઓથી મેલેરિયા ફેલાવાનો ખતરો

(એજન્સી) નવી દિલ્હી, દરેક વ્યક્તિ જાણે છે કે મેલેરિયા મચ્છરો દ્વારા ફેલાય છે, તેથી લોકો તેનો સામનો કરવા માટે વ્યવસ્થા કરે છે. પણ પ્રત્યક્ષને બદલે હવે એનો પરોક્ષ સ્રોત પણ હશે, ભાગ્યે જ કોઈ જાણતું હશે. પરંતુ આ તે દેશ્યમાં થવા લાગ્યું છે જ્યાં પ્રવાસીઓ મોટા પાયે પહોંચે છે. તેથી સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓની ભીડ ઓછી કરવા

ચેતવણી પણ જારી કરવામાં આવી રહી છે. થાઈલેન્ડમાં મચ્છરોને બદલે વાંદરાઓથી મેલેરિયા ફેલાવવાનું જોખમ વધી રહ્યું છે. આ જ કારણ છે કે પોલીસ પ્રવાસીઓને આવા જંગલોથી દૂર રહેવાની ચેતવણી આપી રહી છે જ્યાં મેલેરિયાગ્રસ્ત વાંદરાઓ રહે છે. આ સાથે પ્રવાસીઓ, મજૂરો અને જંગલોમાં કે તેની નજીક રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ

પ્રવાસીઓને આવી જગ્યાઓથી દૂર રહેવાની ચેતવણી

મચ્છરોથી બચવા માટે તમામ વિશેષ વ્યવસ્થાઓ સાથે રહે. જણાવવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે ઓક્ટોબરથી માર્ચની વચ્ચે આવા મામલાઓમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષના ઑક્ટોબર અને માર્ચના અંતની વચ્ચે, પ્લાઝમોડિયમ નોલેસી, એક પ્રકારનો મેલેરિયાના કુલ ૭૦ કેસ નોંધાયા હતા, જે અગાઉના વર્ષમાં માત્ર ૧૦ હતા. એટલે કે મેલેરિયાના કેસ પહેલા કરતા ઝડપથી વધી રહ્યા છે તે જોતા થાઈલેન્ડમાં બહારથી આવતા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. રોગ નિયંત્રણ વિભાગના ડો. ઓપર્ટ કર્નાકાવિનપોંગે જણાવ્યું હતું કે આરોગ્ય વ્યવસાયિકોએ હજુ સુધી એ નક્કી કર્યું નથી કે તાવ, શરદી

ભૂખ ન લાગવા માટેનું ખતરનાક પરોપજીવી માનવ-થીં માનવમાં સંક્રમણનું જોખમ છે કે કેમ. તાવ, શરદી, ભૂખ ન લાગવાના લક્ષણો જોવા મળતા લોકો અંગે વહીવટીતંત્ર સતર્ક છે. આવા લોકોને તાત્કાલિક સારવાર અથવા તબીબી સહાય માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, એ પણ સુનિર્શ્વિત કરવામાં આવી રહ્યું છે કે દક્ષિણના પ્રાંત રાનોંગ, સોંગખલા અને પૂર્વીય રાજ્યો ત્રાટમાં, જો તેઓ કોઈપણ રીતે વાંદરાઓના સંપર્કમાં આવે છે, તો તેમને તાત્કાલિક તબીબી તપાસ અને સારવારની જરૂર છે. આ સાથે જોખમ ધરાવતા લોકોને ચુસ્ત કપડા પહેરવા, મચ્છરદાનીમાં સૂવા અને મચ્છર ભગાડવાની વ્યવસ્થા અંગે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે થોડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જો મોડું થાય તો જીવ

રાજચમાં વીજળીની માગ વધતાં સિક્કાના બે પ્લાન્ટ શરૂ કરાયા

બંને પ્લાન્ટ ૫૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે

(એજન્સી) વડોદરા,

છેલ્લા કેટલાક સમયથી ગરમીમાં વધારો થતાં રાજયમાં વીજમાંગમાં વધારો થયો છે. જેના પગલે ઉનાળા પહેલાં વીજપુરવઠાની માંગ ૧૮,૦૦૦ મેગાવોટ હતી જે હાલ વધી ૨૧,૦૦૦ મેગાવોટની ઉપર પહોચી છે. ત્યારે વીજમાગને પહોચી વળવા કોઈ સમસ્યા ના સર્જાય તેના માટે જીયુવીએનએલ દ્વારા જામનગર ખાર્તેના સિકકા વીજપ્રોજેકટના ૫૦૦ મેગાવોટના બંને પ્લાન્ટ શરૂ કરી દેવાયા છે. અને સિકકા પ્લાન્ટમાં વપરાતાં વિદેશી કોલસાનો ૧૨ લાખ મેટ્રીક ટન જથ્થો અંદાજે રૂ.૧,૬૮૦ કરોડનો જથ્થો

જીયુવીએનએલ દ્વારા મગાવાયો છે. વીજ કંપનીના એક ટોચના અધિકારીઓ જણાવ્યું હતું કે વિદેશી કોલસાથી ચાલતાં પ૦૦ મેંગાવોટનો સિકકા ખાતેના પ્લાન્ટ શરૂ કરી દેવાયા છે. સિકકા પ્લાન્ટ માટે જરૂરી કોલસો ઈન્ડોનેશીયાથી મંગાવાયો છે. ૧૪,૦૦૦ રૂપિયે મેટ્રીક ટનના ભાવે ઈન્ડોનેશીયામાં મળતો કોલસોને ૧૨ લાખ મેટ્રીક ટનનો ઓર્ડર જીયુવીએનએલ દ્વોરા આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઓગષ્ટ સપ્ટેમ્બર અને જાન્યુઆરીફ્રેબુઆરી વીજપુરવઠા માટે પીકસીઝન ગણાય છે. કારણ કે આ સમયમાં એગ્રીકલ્ચરમાં પણ વીજપુરવઠાની માંગ વધુ હોય છે. એટલે વીજમાંગમાં વધારો થાય છે. પણ ઉનાળો આવતાં ડોમેસ્ટીક ક્ષેત્રે પણ

વીજમાંગમાં વધારો થાય છે. પણ

ઉનાળામાં એગ્રીકલ્ચર ક્ષેત્રે માંગ

ઓછી હોય છે. એટલે ડોમેસ્ટેક

ક્ષેત્રની માંગને વીજ કંપનીઓ પહોચે

ડોમેસ્ટિક ટુરિઝમ પર ફોક્સ કરવું પડશે : પર્યટન મંત્રી હવે જો કે કોરોનાનો પ્રકોપ પર્યટકોને હવે રાજસ્થાન ફરવામાં (એજન્સી)જયપુર, ઓછો થતા ધીરે ધીરે પર્યટનને પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે. ધમધમતો કરવાના પ્રયત્નો થઈ રાજ્ય પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે રહ્યા છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે કહ્યું કે બે વર્ષમાં રાજસ્થાનમાં પર્યટન રાજસ્થાન પણ આગળ પડતું રાજ્ય સંપૂર્ણ રીતે ખતમ થયું છે. હવે સરકારની કોશિશ છે કે પ્રયત્નો કરીને

કોરોના વાયરસે માત્ર

ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી પર્યટન ઉદ્યોગ પણ ખુબ પ્રભાવિત થયો છે. જેંંંંંં અર્થવ્યવસ્થા પર કમરતોડ ફટકો

છે જ્યાં દેશ વિદેશથી ઢગલો પર્યટકો આવે છે. ઐતિહાસિક સ્થળો અને સાથે સાથે કુદરતનો રોમાંચ માણવા પર્યટકો રૉજસ્થાન પર કળશ ઢોળતા હોય છે. કોરોનાના પ્રભાવથી રાજસ્થાન પણ બાકાત નથી. રાજ્યના પર્યટનમંત્રી વિશ્વેન્દ્ર સિંહે આ કડીમાં છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે રાજસ્થાનના પર્યટન ઉદ્યોગને કેટલો ફટકો પડ્યો છે

તેની વિગતવાર માહિતી આપી. આ

સાથે તેને ફરીથી ધમધમતો કરવા આપવાની કોશિશ થઈ છે. 'મેગા પ્લાન' પણ જણાવ્યો. જે રાજસ્થાનના ટુરિઝમમાં જોતા એવું લાગે છે કે લોકલ પેલેસ ઓન વ્હિલ્સનું પણ એક

આગવું આકર્ષણ છે. પરંતુ તેનું ભાડું વધારે હોય છે. આ અંગે પણ રાજ્ય પર્યટન મંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે પેલેસ ઓન વ્હીલ્સનું ભાડું સસ્તું કરવામાં આવશે. પહેલા ડોલર અને યુરોમાં લોકો ભાડું ચૂકવતા. ટિકિટ પણ સાડા ૪ લાખ હેતી પરંતુ હવે ટિકિટ

દોઢ લાખ સુધીની થશે.

રાજ્ય પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહના જણાવ્યાં મુજબ હાલ વિદેશથી ફક્ત ૧૦ ટકા લોકો ફરવા માટે આવે છે આથી અમે ડોમેસ્ટ્રિક ટુરિઝમ્ પર ધ્યાન્ આપી રહ્યા છીએ. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે રાજ્યમાં ધાર્મિક, સાંસ્કૃતિક, વાઈલ્ડલાઈફ અને હેરિટેજ એમ બધુ મળીને નવી સર્કિટ્સ પણ બની રહી છે. રાજ્યએ ટુરિઝમની ફિલ્મ પોલીસી પણ બનાવેલી છે. ખુબ રિબેટ્સ આપ્યા છે. લોકલ જીએસટી પેણ ચાર્જ કરવામાં આવતો નથી. અત્રે જણાવવાનું કે આગામી વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી છે. પર્યટનમંત્રીએ કહ્યું કે બધા લોકો ઈલેક્શન મોડમાં આવી જાય તે પહેલા રાજસ્થાનમાં પર્યટન ક્ષેત્રે

डेन्द्र हिल्हीमां यार পूना मंहिरो તોડી પાડશે : આપ નેતા આતિશી

(એજન્સી) નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી પર મોટો હુમલો કરતા આમ આદમી પાર્ટીએ સનસનીખેજ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારની દિલ્હીમાં ચાર મંદિરો તોડવાની યોજના છે. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર રાષ્ટ્રીય રાજધાનીમાં બુલડોઝરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે, અને દાવો કર્યો છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે દિલ્હીના સરોજિની નગર વિસ્તારમાં ચાર મંદિરોને તોડી પાડવાનું પગલું ભરશે.

દિલ્હીમાં પાર્ટી હેડકવાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આતિશીએ કહ્યું કે આવી હતી. જેમાં સરોજિની કેન્દ્રને કેન્દ્રીય ગૃહ અને શહેરી નગર વિસ્તારમાં પ્રાચીન શિવ લીધી.

બાબતોના મંત્રાલયે આ ચાર મંદિર, એચ બ્લોકમાં સાંઈ મંદિરોને તોડવાની નોટિસ મંદિર અને જે બ્લોકમાં શનિ મોકલી છે. આતિશીએ આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં બુલડોઝરની રાજનીતિ કરી રહીં છે. તેના નેતાઓ અને કાઉન્સિલરો લોકોને ધમકી આપી રહ્યા છે કે જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેઓ તેમના ઘરો અને દુકોનો પર બુલડોઝર ચલાવશે. આદમી પાર્ટીના નેતાએ કેન્દ્રીય મંત્રાલયની નોટિસોની નકલો પણ બતાવી, જેનો તેણીએ દાવો કર્યો હતો કે સત્તાવાળાઓ દ્વારા ત્રણ પ્રવેશદ્વાર પર પેસ્ટ કરવામાં

મંદિરનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીએ તાજેતરમાં કહ્યું હતું કે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે દિલ્હીના શ્રીનિવાસપુરીમાં મંદિર પરિસરમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાના પગલાના ભાગ3પે મંદિરના કબજેદારોને ખાલી કરાવવાની નોટિસ જારી કરી હતી. આ પગલાની નિંદા કરતા આતિશીની આગેવાની હેઠળના પક્ષના નેતાઓએ ૨૩ એપ્રિલના રોજ શ્રીનિવાસપુરીમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે વિરોધ પ્રદર્શન કર્યું અને કેન્દ્રને તેને તોડી ન દેવાની પ્રતિજ્ઞા

૨૦ દિવસમાં એક જ જગ્યાએ સાસુ અને વહુની હત્યા

બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી

એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. જ્યાં સાસુ અને વહુની ૨૦ દિવસમાં એક જ જગ્યાએ આ જ રીતે હત્યા કરવામાં આવી હતી. આ બે હત્યાના કેસ પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. આ ઘટના પૂર્ણિયા જિલ્લાના બધરા પોલીસ

ચાર પતિ અને પાછો એક બોચફ્રેન્ડ, મહિલાની ધરપકડ

(એજન્સી) નાગપુર, મહાભારતમાં દ્રોપદીના પાંચ

પતિ હતાં એ વાત તો જાણીતી છે પ્રંતુ અહીં નાગપુરમાં એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેને જાણીને તમારા હાજા ગગડી જશે. એક મહિલાએ ચાર પુરુષો સાથે લગ્ન કર્યા હતા અને વળી પાછો એક બોયફ્રેન્ડ પણ રાખ્યો હતો. જો કે પોલીસે મહિલાની અનેક પુરુષો સાથે લગ્ન કરવા અને વસૂલીના આરોપસર જ્યારે ધરપકડ કરી તો અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા. એક પોલીસ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપતા કહ્યું કે મહિલા અને તેના બોયફ્રેન્ડે આ સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો. મહિલા તેના ચારેય પતિઓ પાસેથી ઢગલો પૈસા વસૂલતી હતી.

સ્ટેશનના ભટોતર ગામમાં બની છે. જ્યાં પહેલા ગુનેગારોએ મહિલાની સાસુની હત્યા કરી હતી અને બરાબર ૨૦ દિવસ બાદ મૃતકની વહુની પણ હત્યા કરવામાં આવી હતી. પર્ણિયાના બધરા પોલીસ સ્ટેશનના ભટોતર ગામમાં ૨૦ दिवस पडेला सासुनी डत्या કરવામાં આવી હતી. ગત સાંજે પુત્રવધૂની તિક્ષ્?ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગે મૃતક હબિયા દેવીના પુત્રએ જણાવ્યું કે, તેની માતા બરહારાથી રાત્રે તેની દુકાનેથી પરત ફરી રહી હતી. ત્યારે ભટોતરમાં પોલીસ સ્ટેશનથી માત્ર ૨૦૦ મીટ**ર** દૂર રેલવે ડમ્પ પાસે કોઈએ તેની માતા હબિયા દેવીના માથા પર પાછળથી તીક?ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું

ત્યાં જ મોત થયું હતું. તેણે આ ઘટના પાછળ પાડોશી લક્ષ્મણ શર્માને જવાબદાર ગણાવ્યો. જોકે, પોલીસે ડોગ સ્કવોડની ટીમ સાથે દરોડો પાડીને મૃતકના ભત્રીજાની ધરપકડ કરી હતી. કહેવાય છે કે આ પહેલા પણ તેણે પોતાની જ દાદીને હથિયાર વડે કાપીને હત્યા કરી હતી. ગત સાંજે તેણે તેની માસીને તિક્ષ્?ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે. પોલીસ મૃતકના ભત્રીજાની પૂછપરછ કરી રહી છે.

રેલવે રનિંગ સ્ટાફની મનપસંદ ચા, નાસ્તા અને ભોજન ઉપર લગામ મુકી દેવામાં આવી

રાજસ્થાનના પર્ચટન ઉદ્યોગને ઊભો કરવા માટે

(એજન્સી) નવીદિલ્હી,

रें बवे रिनंग स्टाई (बोडो પાયલટ અને ગાડ)ની મનપસંદ ચા, નાશ્તા અને ભોજન ઉપર લગામ મુકી દેવામાં આવી છે. ગંતવ્ય ચા, નાશ્તો અને ભોજન કરવા (મુળ) સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ઉપરાંત રેશનિંગ સહિતની અન્ય બાદ તેણે રનિંગ રૂમમાં તૈયાર ભોજનના ભરોસે જ હવે રહેવું પડશે. જો કે કર્મચારી સંગઠનોએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. કર્મચારી સંગઠનોએ આ વિષયને રેલવે બોર્ડ સામે ઉઠાવવાનો નિર્ણય

નવી વ્યવસ્થા હેઠળ એક વખત પ્રવેશ બાદ રનિંગ સ્ટાફને પરત ટ્રેન દેવામાં આવ્યો છે.

લઈ જવા સુધી જ રનિંગ રૂમમાંથી નીકળવાની પરવાનગી રહેશે. વચ્ચે તેને નિર્ધારિત સમય સુધી રનિંગ રૂમમાં જ વિશ્રામ કરવાનો રહેશે. વસ્તુની ખરીદારી માટે પણ તે બહાર જઈ શકશે નહીં.

ડોમેસ્ટિક એટલે કે ઘરેલુ પ્રવાસીઓને

राष्ठस्थान साववा माटे प्रयत्नो

કરવામાં આવે. તેમના જણાવ્યાં

મુજબ રાજસ્થાનના પર્યટન ઉદ્યોગને

ઊભો કરવા માટે ડોમેસ્ટિક ટુરિઝમ

પર ફોકસ કરવું પડશે કારણ કે

વિદેશથી તો પ્રવાસીઓને આવતા વર્ષ

જેટલો સમય લાગશે. તેમના

જણાવ્યાં મુજબ ૨૦૨૦માં

રાજસ્થાનમાં પર્યટન પોલીસી બની.

પર્યટનને એક ઈન્ડસ્ટ્રીનો દરજ્જો

આ ઉપરાંત વિશેષ પરિસ્થિતિમાં રનિંગ રૂમમાંથી બહાર જવા માટે પ્રભારી પાસેથી લેખિત પરવાનગી લેવાની રહેશે. આ વ્યવસ્થાને લાગુ કરવા માટે પ્રભારીઓને આદેશ પણ આપી

નવા ઈમ્પ્લિમેન્ટેશન કરવાના છે. CHANGE OF NAME

I Hitherto Known As **CHAUDHARI VANDANA** W/o **DILIP** Residing At 157-1, Laxminagar, Nr.Last Bus Stop Meghaninagar, Ahmedabad-380 016 Have Changed My Name And

hereafter Be Known As LATABAI DILIP CHAUDHARI

સિક્યોર્ડ એસેટ (स्थाઇ मिલ्કत)नुं **વર્ણ**न

ફ્લેટ નં.૩૦૭, ત્રીજો માળ એરીયા આશરે ૫૧૧.૯૮ સ્કે.ફીટ

કલેટ નં.એક-ર, પહેલો માળ, આશરે ૧૪.૨૪ સ્કે.મીટર્સ કાર્પેટ એરીયા અવિભાજય શેર કોમન એરીયા આશરે ૫.૪૦ સ્કે.મીટર્સ અને કુલ ૧૯.૬૪ સ્કે.મી. ભાષકામ જમીન સ્કિમ આવાસ કોમસિયલ કોમ્પેસલ, મારેયા, ચોગોદર, અમદાલ-૩૮૨૧૧૦, ગુજરાત, ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત

ડોક્ટર પતિના મોતનો આઘાત સહન નહિ થતા પ્રોફેસર પત્નિનો આપઘાત

મધ્યપ્રદેશના ભોપાલમાં ડોક્ટર પતિના મોતના સમાચાર રાખવામાં આવ્યા હતા. સાંભળ્યા બાદ માત્ર એક જ કલાકમાં મૃતકના પ્રોફેસર પત્નીએ પણ પતિના મોતનો આઘાત સહન જણાવ્યું હતું કે તેમના પતિ પરાગનું નહિ થતા ભોપાલના ભદભદા બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી પતિ-પત્નીની અર્થી એકસાથે ઊઠતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

આ કરૂણ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ભોપાલના જાનકીનગર, યૂનાભટીમાં રહેતા હવે તેમને જીવવાનો કોઈ અર્થ ૪૭ વર્ષના ડોક્ટર પરાગ પાઠક ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા.૨૮ એપ્રિલની સવારે ૯ વાગે ડોક્ટર પાઠકની તબિયત અચાનક બગડતાં તેમનાં આસિસ્ટન્ટ હતા બીજી તરફ હોસ્પિટલ પ્રોફેસર પત્ની પ્રીતિ ઝારિયા (૪૪)એ પતિને સારવાર માટે અરેરા કોલોની સ્થિત નેશનલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેઓનું બ્રેન હેમરેજનું નિદાન થયું

(એજન્સી)ભોપાલ, અને ગંભીર સ્થિતિમાં બીજા દિવસે પ્રીતિએ મોતની છલાંગ લગાવી સર્જરી બાદ તેમને વેન્ટિલેટર પર

> દરમિયાન તા. ૨જી મેની રાત્રે લગભગ ૨ વાગે ડોક્ટરે પ્રીતિને મોત થયું છે. આ સાંભળી ભારે આઘાતમાં આવી ગયેલી પ્રીતિએ મોટા ભાઈને ફોન કર્યો. આ સાંભળીને બન્ને ભાઈ રાજેન્દ્ર કુમાર ઝારિયા, રાજેશ કુમાર ઝારિયા હોસ્પિટલ આવવા નીકળી ગયા. આ સમયે પ્રીતિએ ડોક્ટરને કહ્યું કે નથી. આ દુનિયામાં મારું કોઈ નથી. તેઓ ભદભદા બ્રિજ પર આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. તેમ કહીને કાર લઈ નીકળી ગયા પહોંચેલા ભાઈઓએ ડોક્ટરને પૂછતાં તેઓએ આખી વાત જણાવતા બરો ભાઈ પ્રીતિને શોધવા માટે ભદભદા તરફ જતા

દીધી હતી ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

જબલપુરની રહેવાસી પ્રીતિ ભોપાલમાં નરેલા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતાં. તેમના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. બન્નેને કોઈ સંતાન ન હતા. ડોક્ટર પરાગ પાઠકના પિતા હરિશંકર પાઠક ડેપ્યુટી કલેક્ટર હતા. તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું, જ્યારે પરાગની માતા શોભા પાઠક સ્ત્રીરોગ નિષ્ણાત છે. તેઓ દીકરા અને વહુ સાથે રહેતાં હતાં. દીકરાની તબિયત બગડતાં તેઓ હોસ્પિટલમાં જ તેમની સાથે હતાં. મંગળવારે રાત્રે પણ તેઓ વહુની સાથે હતાં,દીકરાના મોત બાદ તેઓ હોસ્પિટલમાં જ ભાગી પડ્યા હતા હવે પોતે એકલાજ આઘાત સહન કરવા બચી ગયા છે.આ ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં તેઓ ત્યાં પહોંચે ત્યા સુધીમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

સુરભી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

CIN NO. L17110GJ1992PLC017672 રજી. ઓફિસ : 'સુરભી હાઉસ' બીજો માળ, એફ.પી. નં.૨૦૬, જુની સબ જેલ પાછળ, રીંગ રોડ, ખટોદરા, સુરત, ગુજરાત-૩૯૫૦૦૨

नोटिस

સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર રીક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ના રેગ્યુલેશન ૩૩ તેમજ રેગ્યુલેશન ૪૭ અનુસાર, **નોટિસ** આપવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક **૧૨મી મે, ૨૦૨૨** ના રોજ **બૃપોરે ૧૨.૦૦** વાગ્યે કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે અન્ય કામકાજની સાથે ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પરા થતા કંપનીના ત્રિમાસીક અને વર્ષના અંત માટેના ઓડિટેડ નાંણાકીય હિસાબો મંજૂર કરવા અને રેકોર્ડ કરવા મળશે.

વધુ વિગતો કંપનીની વેબસાઇટ www.surbhi.com તેમજ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

> બોર્ડના આદેશ અનુસાર સુરભી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ સહી/

ક્શંત : સેંડવ તારીખ : ૦૪.૦૫.૨૦૨૨ વજાભાઇ પરબતભાઇ પટેલ મેનેજીંગ ડાયરેક્ટર (DIN: 00023332)

Franklin Templeton Mutual Fund Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative.

Venue: Angat - 22 The Restaurant & Banquet, Daffodils Plaza, Gala Gymkhana Rd, South Bopal, Ahmedabad. Date: 7th May, 2022

Contact Person: Utkarsh Rastogi (7710801123) Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow.

All Covid protocols will be followed,

We look forward to your participation. FRANKLIN TEMPLETON

Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks. read all scheme related documents carefully.

ડીમાન્ડ નોટીસ

સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકસ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ગની માર્ચ વાંચતા, આઇઆઈએકએલ ગુહ ફાઇનાન્સ લિમિટેડ (IPE HFL) (અગાઈ ઉન્સ્યિ ઇન્ફોલાઇન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ)ના અધિકૃત અધિકારીએ જારી કર્યા છે. ઉપરોક્ત અધિનયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગણી નોટિસ, ઉધાર લેનારા (આં) ને, તેઓને સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ રકમ પરત કરવા માટે હાકલ કરે છે. ઉપરના સંબંધમાં, કરીથી આ સુચના પ્રકાશિત થયાની તારીખથી ૬૦ દિવસની અંદર લેણદાર(ઓ)ને ચૂકવણી કરવા માટે સુચના આપવામાં આવે છે, ના વધુ વ્યાજ સાથે, નીચે જણાવેલ રકમ, ઓ માંગણી સુચના ચુકવણીની તારીખ સુધી લેણદાર (ઓ) ની વિગત, તારીખ મુજબની રકમ માંગની સૂચના અને લોનની રકમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છેઃ

મયુરેશ આર ચૌહાણ, શ્રીમતી. મિતાલી મયુરેશ ચોહાણ (Prospect No.735678)	30-Apr-2022 Rs.4,96,819/- (રૂપિયા ચાર લાખ છશું હજાર આઠસો ઓગણીસ ફક્ત)	શિવાલય ફ્લેટ્સ સીટીએસ નંબરો ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૦ અને ૨૦૫, ગામ તરસાલી વડોદરા, ગુજરાત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત
શ્રી. રીપુલ દેવજીભાઇ હિહોરીયા, શ્રીમતી. ચેતનાબેન રીપુલભાઇ હિહોરીયા, પ્રમુખછાયા ક્રિએશન (Prospect No.787841)	30-Apr-2022 Rs.6,32,418/- (રૂપિયા છ લાખ બત્રીસ હજાર ચારસો અઢાર ફક્ત)	જી-૩૦૧ એલઆઇજી-૫, આશરે બિલ્ટ અપ એરીયા ૪૨.૦૪૬ સ્કે.મીટર્સ, કાર્પેટ એરીયા ૩૬.૦૦૧ સ્કે.મીટર્સ સુમન આનંદ કોલોની, ટીપી-૩, રૂપ, સુરત, ગુજરાત, ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત
શ્રી. બિજલભાઇ નાગજીભાઇ કટારીયા, એચ.કે. લેસ, શ્રીમતી. રેખાબેન બિજલભાઇ કટારીયા (Prospect No.789504)	30-Apr-2022 Rs.22,07,096/- (રૂપિયા બાવીસ લાખ સાત હજાર છમું ફક્ત)	પ્લોટ નં. ૧૩૫ આશરે ૩૯.૦૩ સ્કે.મી. ૩૨.૯૮ સ્કે.મી. બાંધકામ, ૧૦.૦૦ સ્કે.મી. અવિભાજ શેર સાથે, શિવ પાર્ક સોસા, ૧૫નગરની પાસે, ગોડાદરા, સુરત, ગુજરાત-૩૯૫૦૧૦, ભારત ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત
શ્રી. કલપેશ એચ માછી, શ્રીમતી. લક્ષ્મીબેન કલપેશભાઇ માછી (Prospect No.822915 & 920601)	30-Apr-2022 Prospect No.822915 Rs.9,46,052/- (રૂપિયા નવ લાખ છેતાલીસ હજાર બાવ્યન ફંક્ત) Prospect No.920601 Rs.2,61,338/- (રૂપિયા બે લાખ એકસઠ હજાર ત્રણસો આડત્રીસ ફંક્ત)	કલેટ ને એ-૩૦૨, પ્રાઇમ પ્લાઝા, આશરે ૩૫, ૧૦ સ્કે.મી. (કાર્યેટ એરીયા), ફુરદર્શનની પાસે, ૭૫ મીટર મેઇન રોડ, વાયોડીયા રોડ, વડોદરા, નેકસ્ટ થી અંબોદર, વડોદરા, ગુજરાત, ભારત- ૩૯૦૦૧૯ ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત
શ્રી. રામશરણ ભૂમિનંદા ખાનાલ, મેસર્સ હિમાલયા કેટરીંગ સર્વિસ, શ્રીમતી. સેજલ જયંતિલાલ રાઠોડ (Prospect No.831841)	30-Apr-2022 Rs.12,78,525/- (રૂપિયા બાર લાખ ઇઠચોતેર હજાર પાંચસો પચ્ચીસ ફક્ત)	ફલેટ નાં ૨૦૭, બી-વિંગ આશરે ૫૧૨ સ્કે.ફટ (બિલ્ટ-અપ એરીયા) અને ૪૬૨.૪૫ સ્કે.ફીટ (કાર્પેટ એરીયા), તુલીપ બિલ્ડીંગ બ્લોસમ પાર્ફ, પ્રોજે ક્ટ રે.સર્વે ના ૧૧૧,૧ વર્ગ કર્ય નાં.૯૮.૯૯, ગામ કડોદરા, નુરી મીડીયાની પાછળ, સુરત, ગુજરાત, ભારત-૩૯૫૦૦૭ ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત
શ્રી. જીતેન્દ્રકુમાર આર. તિવારી, શ્રીમતી. નૂતનકુમારી જીતેન્દ્રકુમાર તિવારી, (Prospect No.832313)	30-Apr-2022 Rs.14,11,286/- (રૂપિયા ચૌદ લાખ અગીયાર હજાર બસો છથાંસી ફક્ત)	નોન એગ્રીકલ્ચર જમીન રજીસ્ટર રહેણાક જમીન સાથે સર્વે નં.૨૮૪, ૨૮૫ અને ૨૧૦, પ્લોટ નં.૩૦૪, આશરે ૪૦.૧૯ સ્કે.મી. વિ.કે. પાર્ક, તાતીથૈયા, પલસાણા, તાતીથૈયા, સુરત, ગુજરાત, ભારત-૩૯૪૩૨૭ ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત

લાખ અડતાલીસ હજાર ચારસો બાંસઠ શ્રી. ભરત માધવ ગવાલે, શ્રીમતી. આશાબેન ગવાલે, 30-Apr-2022 Rs.13,75,191/- (રૂપિયા તેર શ્રી. માધવ ગાવડે (Prospect

વેનુભાઇ સામજીભાઇ વાધરી, શ્રીમતી. મંજીબેન વિનુભાઇ

દેતાશીયા (Prospect No.839196 & 919803)

30-Apr-2022 Prospect No.839196

Rs.7,85,726/- (રૂપિયા સાત લાખ પંચ્યાસી

હજાર સાતસો છવ્વીસ ફક્ત) Prospect No.919803 Rs.1,48,462/- (રૂપિયા એક

પ્લોટ નં. દ૧ આશરે ૫૩.૩૬ રહે. યાડ્સ એટલે કે ૪૪. દ૨ રહે. મી. કે.જે. પી બ્લોક નં. ૧૨૧/દ૧ આશરે ૪૦. ૨૩ રહે. મી. સાંઇ દર્શન રેસીડેન્સી રેનેન્યુ સર્વે નં. ૯૩/૧, બ્લોક નં. ૧૨૧ આશરે હે. એરીયા ૨-૩૯- દ૩ રહે મી. મોજે ગામ ભુગરા. તા. પલસાસા, જી. સુરત, ગુજરાત-૩૯૫૦૧૦ ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત

શ્રી. પી.જે. છાંટબાર, શ્રીમતી. ભાવના, પિયુષભાઇ છાંટબાર, શ્રીમતી. નિર્મેલાબેન જગદીશભાઇ છાંટબાર 30-Apr-2022 Prospect No.842978 ફ્લેટ નં.એમ/૪૨૨, કોલોની નં.૯૬ એમ.આઇ.જી. સર્વે Rs.8,34,324/- (રૂપિયા આઠ લાખ ચોત્રીસ નં.૬૧,૬૨, આશરે ૫૧.૩૬ સ્કે.મી. આનંદનગર, ભાવનગર, હજાર ત્રણસો ચોવીસ ફક્ત) Prospect ગુજરાત-૩૬૪૦૦૩, ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત Rs.8,34,324/- (રૂપિયા આઠ લાખ ચોત્રીસ હજાર ત્રણસો ચોવીસ ફક્ત) Prospect wik ત્રેલાના વાવાસ ફક્ત) Prospect No.920733 Rs.1,51,022/- (રૂપિયા એક લાખ એક્કાવન હજાર બાવીસ ફક્ત) (Prospect No.842978 & 920733) શ્રી. મહેશગીરી ચેહરગીરી 30-Apr-2022 Rs.8,75,773/- (રૂપિયા યુનિટ/ક્લેટ નં.એક-૧૧૦, આશરે ૩૭.૬૩ રકે.મી., નેબુલા આઠ લાખ પંચોતેર હજાર સાતસો તોત્તેર કક્ત) સહિત ત્રા. નહરાગારા વહેરગારા ગોસ્વામી, શ્રીમતી. મધુબેન મહેશભાઇ ગોસ્વામી (Prospec No.886008) શ્રી. વિશાલસિંઘ વજેસિંઘ

30-Apr-2022 Rs.4,85,883/- (રૂપિયા ચાર મિલકત નં.૩૨, અશરે ૧૨૦૦ સ્કે.ફીટ (૧૧૧.૫૨ સ્કે.મીટર્સ) લાખ પંચ્યાસી હજાર આઠસો ત્યાંસી ફક્ત) બારત-૩૮૫૦૦૧ ખાતે આવેલ મિલકતના બધા ભાગો સહિત ચૌહાણ, શ્રીમતી. નાથુબા, મેસર્સ મિલ્ક ઇન્કમ (Prospect No.IL10113465) જો આ દેવાદાર ઉપરોક્ત IIFL, HFLને ચૂકવણી કરવામાં નિષ્કળ જાય તો IIFL, HFL આ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ ઉપરોક્ત સિક્યોર્ડ એસેટસ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમો/સમગ્રપણે તે દેવાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીનીઃ હાંચ ઓફીસ : IIFL, HFL ૩૦૩, ત્રીજો માળ, ભગવાનદાસ ચેમ્બર્સ, સિંદેટ હાઉસની સામે, આર.સી. દત્ત રોડ, વડોદરા,પીનકોડ-૩૯૦૦૦૭ અને ઓફીસ નં. ૭૦૧, સાતમો માળ, 21 જ સેન્સ્યુરી બિઝનેસ સેન્ટર, ઉધના દરવાજા પાસે, રીંગ રોડ, સુરત-૯૫૦૦૨ અને અમદાવાદ કોમર્સ હાઉસ, ચોચો માળ, કોમર્સ હાઉસ-૪, શૈલ પેટ્રોલ પંપની પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-૩૮૦૦૫ અને પહેલો માળ, સોમનાથ પ્લાઝા, ફિટનેસ ક્લબ નીચે, આબુ રોડ હાઈવે, પાલનપુર, બ.કાં(ગુજરાત)-૩૮૫૦૦૧/ અથવા કોર્પોરેટ ઓફિસ: આઇઆઇએકએલ ટાવર પ્લોટ નં.૯૮, ઉદ્યોગ વિહાર, ફેસ-૪, ગુરગાંવ, હરીયાણા સંપર્ક કરવો.

સ્થળઃ વડોદરા, & સુરત & અમદાવાદ & પાલનપુર તા. ૦૫.૦૫.૨૦૨૨ સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટેડ વતી

વેસ્ટર્ન ટાઇસ્સ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

"પ્રભુને ગમે" પુસ્તિકાઓ વહેચો વર્ષગાંઠ,પુણ્યતીથીઓ બેસણામાં વિ "જ્ઞાનયજ્ઞ",સંસારમાં સ્વર્ગીયતા લાવે

ઘરડાઘરો ને છુટાછેડાઓ અટકે દાંપત્યો ને કુંટુંબો ભાવપૂર્ણ બને સુખી.શુચી,શ્રીમતો,હજારો લાખોમાં વહેચે. માતાપિતા.કુળવંશજોના ફોટાઓ સાથે-૧૬-૨૪ પેજમાં તમારુ લખાણ મૂકીને, પુસ્તિકાઓ વહેચી પાછલી પેઢીને, કુળ.કિર્તીની ભવ્યતા નો ગોરવપૂર્ણ, ઇતિહાસ,આપવો તે જાગૃત,બુ^{દે}ધીમાનોનું,શ્રેષ્ઠ કર્મ છે કયાં, કેવી રીતે. વહેચવી. ફોન કરો ભાવો.રૂા.૫/-૯/-૧૦/-૧૩/-૨૪/-

દાંદાર્થી નથીઃ મો.૮૧૨૮૨૮૬૧૬૧

ફોર્મ નં. URC-2

પ્રકરણ XXIના ભાગ ૧ હેઠળ નોંધણી વિશે નોટિસ આપતી જાહેરાત (કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૭૪(બી) અને કંપનીઓના

નિચમ ૪(૧) અનુસાર (નોંધણી માટે અધિકૃત) નિચમો, ૨૦૧૪) આથી નોટિસે આપવામાં આવે છે કે કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ ૩૬૬ની પેટા કલમ (૨)ના અનુસંધાનમાં, પંદર દિવસ પછી અરજી કરવાની દરખાસ્ત છે. પરંતુ પંદર દિવસની સમાપ્તિ પહેલા તે પછી સેન્ટ્રલમાં રજિસ્ટ્રાર રજિસ્ટ્રેશન સેન્ટર (સીઆરસી) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોર્પોરેટ બાબતે (આઇઆઇસીએ) પ્લોટ નંબર ૬,૭,૮, સેક્ટર પ, આઇએમટી માનેસર, જીલ્લા ગુડગાંવ (હરિયાણા), પિનકોડ - ૧૨૨૦૫૦, <mark>ચંશું સર</mark> નામની વેપાર કરતી કુંપની એક્ટ, ૨૦૧૩,ના પ્રકરણ XXIના ભાગ ૧ હેઠળ મર્યાદિત શેર દ્વારા કંપની તરીકે નોંધણી કરી શકે છે.

કંપનીના મુખ્ય ઉદેશો નીચે મુજબ છે. સ્વ-માલિકીની અથવા લીઝ્ડ રિયલ એસ્ટેટની ખરીદી, વેચાણ, ભાડા અને સંચાલનના વ્યવસાયને ચાલુ રાખવા માટે જેમ કે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અને રહેઠાણ, બિન-રહેણાંક ઇમારતો, રિયલ એસ્ટેટને લોટમાં વિકસાવવા અને પેટાવિભાજિત કરવા અને તેમાં જમીનનો વિકાસ અને વેચાણનો સમાવેશ થાય છે. કબ્રસ્તાન લોટ, એપાર્ટમેન્ટ હોટેલ્સ

અને રહેણાંક મોબાઇલ હોમ સાઇટ્સનું સંચાલન. સૂચિત કંપનીના ડ્રાક્ટ મેમોરેન્ડમ્ અને આર્ટિકલ્સ ઓફ અસોશિએશનની નકલ ૭૦૧ નોર્થ પ્લાઝા, ૪ડી સ્ક્વેર મોલ, મોટેરા, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૦પ ખાતેની ઓફિસ ખાતે નિરીક્ષણ કરી શકાશે.

આ સાથે એવી નોટીસ આપવામાં આવી છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર કોઇ પણ વ્યક્તિ આ નોટિસ પ્રકાશિત થયાની તારીખથી એકવીસ દિવસની અંદર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઇઆઇસીએ), પ્લોટ ને.૬,૭,૮, સેક્ટર-પ, આઇએમટી માનેસર, ડિસ્ટ્રિક્ટ ગુડગાંવ (હરિયાણા), પિનકોડ-૧૨૨૦૫૦માં તેમના વાંધાની લેખિતમાં જાર્ણ કરી શેકે છે. તેની રજિસ્ટર્ડ ઓફિસમાં કંપનીને એક નકલ સાથે. મે, ૨૦૨૨ના આ ૦૫માં દિવસની તારીખ

અરજદારના નામો ૧. કેયુર દિનેશભાઈ કડીયા ૨. યામિનીબેન નેલેશભાઈ પંડયા

3. સનમકુમાર દિનેશભાઈ કડીયા ૪. આકાશ જયંતકુમાર સુથાવરા પ. જરા રમેશભાઈ પ્રજાપતિ